



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ-14

ફોન : (ઓફિસ) 27545051 - 54. ફેક્સ : (079)-27545061

ઈ મેઇલ : urban@icenet.net વેબસાઇટ : www.audaonline.org

નમુનો ધ
નિયમ -10

વિકાસ માટે પરવાનગી

શ્રી PARTNER,GOKULDHAM DEVELOPERS & OTHERS/10 TH FLOOR,COMMERCE HOUSE-4,NR. ANAND NAGAR,SATELITE,AHMEDABAD. ને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 (સન. 1976 ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં 27) ની કલમ-29 (1)(1),29(1) (2), 49(1) (ખ) હેઠળ મોજે ગામ SANATHAL-TELAV તાલુકો SANAND જિલ્લો AHMEDABAD નગર રચના યોજના નં. SANATHAL-TELAV રે.સ.નં./બ્લોક નં 78,1007,1022, & OTHERS હિસ્સા નં -- મુળખંડ નં ---- અંતિમખંડ નં ----

- સબપ્લોટ નં -----/----- ની 1012418.00 ચો.મી
જમીનમાં તેમની હદમાં નીચે વર્ણન કર્યો પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

કામનું વર્ણન:

અ.નં. 1	(માળ)2	બાંધકામ(બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.) 3	બાંધકામનો ઉપયોગ (4)	એકમની સંખ્યા (5)	રીમાર્ક્સ (6)
1	સેલર/ભોંયડુ	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
2	ફેલોપ્લીનથ	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
3	ગ્રાઉન્ડ ફ્લોર	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
4	ફર્સ્ટ ફ્લોર	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
5	સેકન્ડ ફ્લોર	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
6	સ્ટેર કેબીન	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
7	મશીન રૂમ	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	
	કુલ:	AS PER ANNEXURE	AS PER ANNEXURE	AS PER ANNEXURE	

ક્રમાંક: PRM/69/3/2011/363

તારીખ: 06/08/2011

નાયબ નગર નિયોજક

10 JUN 2011 અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

મ.કે.

સીનીયર નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

અમદાવાદ

- શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬ ચો.મી જગ્યાનું એન્વાયર્મેન્ટ કલીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.
- (૨) મોજે તેલાવના બ્લોક નં.૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/૧, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/૧, ૪૩૪/૧ તથા સનાયલના બ્લોક નં.૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનખેતીનો હુકમ રજુ કરવાનો રહેશે.

ખાસ શરતો:-

- ૧ આ વિકાસ પરવાનગીથી જી.ડી.સી.આર. ના વિનિયમ નં. ૪.૨.૧. મુજબ તેમજ અન્ય લાગુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ મળતી નથી.
- ૨ વિકાસ પરવાનગી મેળવ્યા બાદ સ્થળ ઉપર વિકાસ શરૂ કરતા પહેલાં સાત દિવસ અગાઉ ફોર્મ નં. (d) નું એનેક્સર, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ, વકીંગ ડ્રોઈંગ્સ તથા સોઈલ ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ્સ નિયમાનુસાર રજૂ કરવાના રહેશે.
- ૩ બાંધકામ નીચેના દરેક તબક્કે ફોર્મ નં. ૬(ઐ) થી ૬(d) માં દર્શાવ્યા મુજબનું પ્રોગ્રેસ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાંધકામ શરૂ કરવાનું રહેશે. અ. પ્લીનથ અથવા ભોયરાનું બાંધકામ હોય તો ભોયરા ઉપરનો સ્લેબ ભરવામાં આવે તે પહેલાં બ. પ્રથમ માળના ક. બહુમાળી મકાનમાં વચ્ચેના માળના બાંધકામ વખતે ડ. છેલ્લા માળના બાંધકામ વખતે
- ૪ જી.ડી.સી.આર. ની જોગવાઈ તથા સરકારશ્રીના તા.૨૯-૫-૨૦૦૧ ના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના ફુકમના વિનિયમ નં.૩ અનુસાર બાંધકામના સ્થળની જરૂરિયાતોની જોગવાઈઓનું પાલન થયેથી સ્થળ ઉપર બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- ૫ સેપ્ટીક ટેંક તથા સોફ્ટવેલની સાઈઝ તથા સંખ્યા નેશનલ બિલ્ડીંગ કોડ (આઈએસ ૨૪૭૦) તથા સિવિલ એન્જીનીયરીંગ હેન્ડ બુક બાય-ખજા મુજબ ડ્રેનેજ લે-આઉટમાં દર્શાવવાના રહેશે. તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આર્કિટેક્ટ/ઈજનેર/ સ્ટ્રક્ચરલ એન્જીનીયર/કલેક ઓફ વર્કસ/સાઈટ સુપરવાઈઝર/ડેવલપર/જમીન માલિકની રહેશે.
- ૬ ચીફ ફાયર ઓફિસરશ્રી, અ. મ્યુ.કો.પો. ના તા. ના અભિપ્રાય મુજબ તમામ નિયમો અને શરતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ૭ ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટની જોગવાઈ મુજબ ટેલીફોનની સુવિધા માટે ખાસ જોગવાઈ જમીન માલિકે કરવાની રહેશે.
- ૮ વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર થયેલ નકશાઓનો એક સેટ સ્થળ ઉપર પ્રસિધ્ધ કરવાનો રહેશે
- ૯ બાંધકામ પૂરે થયા બાદ બાંધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલાં નિયમાનુસાર અત્રેથી બાંધકામનું વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ શરૂ કરવાનો રહેશે.
- ૧૦ ૧.ફા.ટી.પી. સ્કીમ સરકાર શ્રી દ્વારા મંજૂર થયેલ, ટી.પી.ઓ.દ્વારા નિર્ણય લેવામાં આવશે તે બંધનકતા રહેશે.
૨.રેલ્વેથી ૩૦.૦ મી. કન્ડોલ લાઈનમાં આવતા મકાનોનું બી.યુ. પરમીશન લેતા પહેલાં રેલ્વેની N.O.C લાવવાની રહેશે.

શરતો:-

- ૧ વિકાસ પરવાનગી પત્રમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવશે તો સત્તામંડળ તે શરતોનો અમલ જવાબદાર ઈસમના/સંસ્થાના ખર્ચે અને જોખમે કરાવી શકશે અને સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે નુકશાન, ખોટ કે હરકત થાય તે બદલ કોઈપણ વળતર કે બદલો મળશે નહીં.
- ૨ પરવાનગીના કારણે અરજદારને માલિકી, જમીનના વિસ્તાર/ક્ષેત્રફળ અંગેની મંજૂરી મળતી નથી પરંતુ બાંધકામ અંગેની મંજૂરી આપવામાં આવે છે.
- ૩ વિકાસ પરવાનગીથી ખાનગી હક્કો અંગે સત્તામંડળની કોઈપણ જવાબદારી રહેતી નથી.
- ૪ મુસદ્દાકૃપ નગર રચના યોજનામાં ફાળવવામાં આવેલ અંતિમખંડની હદ, માપ, ક્ષેત્રફળ તથા ફાળવણી ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી દ્વારા ફેરફારને પાત્ર છે.
- ૫ પ્લોટની હદ, આંતરિક રસ્તા ઉપર, કોમન પ્લોટમાં કોઈને અંતરય રૂપ ન થાય, તે રીતે યોગ્ય સ્થળોએ ૧૦૦.૦૦ ચોરસ મીટર જમીનમાં વિસ્તાર દીઠ એક વૃક્ષ ઉગાડવાનાં રહેશે. વૃક્ષો ની ફરતે જરૂરીયાત મુજબ ટી ગાર્ડ રાખી વૃક્ષો ની સારસંભાળ રાખવાની જવાબદારી જમીન માલિક તથા વિકાસ પરવાનગી મેળવનારની રહેશે.
- ૬ લેઆઉટમાં દર્શાવેલ આંતરિક રસ્તાઓ પાકા કરવાના રહેશે.
- ૭ વખતો વખત શહેરી વિકાસ સત્તામંડ તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જાહેરાત કરાય તે જમીન માલિક, હિતસંબંધ ધરાવતી વ્યક્તિ/સંસ્થા તેમજ અરજદારને બંધનકર્તા રહેશે.
- ૮ સદર વિકાસ પરવાનગી અન્વયે જમીન માલિકીમાં ફેરફાર થાય અથવા આ પરવાનગી સાથે સંકળાયેલ રજીસ્ટ્રેશન ધરાવતી કોઈ વ્યક્તિ બદલાય તો નવા જમીન માલિક અંગેના પુરાવા રજૂ કરે ત્યાં સુધી તથા રજીસ્ટ્રેશન ધરાવતી નવી વ્યક્તિની નિમણૂક ન થાય ત્યાં સુધી જી.ડી.સી.આર. ના વિનિયમ પ.૨ મુજબ વિકાસ પરવાનગી નિલંબીત ગણાશે. સદરહુ સમય દરમિયાન થયેલ બાંધકામ બિનાધિકૃત ગણાશે.
- ૯ સરકારશ્રીના તા.૨૯-૫-૨૦૦૧ ના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના એનેક્સર XI ના વિનિયમ ૧૩,૧૪,૧૫ ની જોગવાઈ અનુસાર ભૂકંપ અંગેની સુરક્ષા, ચક્રવાત અંગેની સુરક્ષા, બાંધકામ તથા બાંધકામમાં વપરાતા ઈમારતી માલ સામાનની ગુણવત્તા અને તેની ચકાસણી, બાંધકામની સ્થિરતા તથા આગ અંગેની સલામતી તેમજ અન્ય ભયજનક બાબતે અંગે નિષ્ણાંતોની સલાહ મૂક્ય ન મુજબ પગલા લેવાની તમામ જવાબદારી આર્કિટેક્ટ/ઈજનેર/ સ્ટ્રક્ચરલ એન્જીનીયર/કલેક ઓફ વર્કસ/સાઈટ સુપરવાઈઝર/ડેવલપર/જમીન માલિકની રહેશે.
- ૧૦ આ વિકાસ પરવાનગી પત્ર મંજૂરી આપ્યા તારીખથી બાર માસ સુધીજ અમલમાં રહેશે. ત્યારબાદ અધિનિયમની કલમ-૩૨ મુજબ વિકાસ પરવાનગીની મુદત વધારવાની પૂર્વે મંજૂરી મેળવી લેવાની રહેશે.
- ૧૧ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૩૩ મુજબ વિકાસ યોજનામાં જો કોઈ ફેરફાર થાય તો સત્તામંડળ આપેલ વિકાસ પરવાનગીમાં ફેરફાર કરી શકશે અથવા વિકાસ પરવાનગી રદ કરી શકશે.
- ૧૨ જી.ડી.સી.આર ના વિનિયમ ૩.૮ મુજબ અરજદારશ્રીએ ખોટી રજુઆત અથવા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ હશે તો આપેલ વિકાસ પરવાનગી આપો આપ રદ થયેલ ગણાશે.
- ૧૩

ક્રમાંક: PRM/69/3/2011/363
તારીખ: 06/08/2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે
સીનીયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

10 JUN 2011

(૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : વાણિજ્ય + રહેણાંક + કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન

અ.નં.	માળ/યુનિટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)									યુનિટ									બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૧		સેક્ટર-૧/એ		સેક્ટર-૧/બી		સેક્ટર-૨		કુલ	સેક્ટર-૧		સેક્ટર-૧/એ		સેક્ટર-૧/બી		સેક્ટર-૨		કુલ	
		એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ		એમુલ (રહેણાંક)	રીવાઈઝ્ડ (કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન)	એમુલ (રહેણાંક + હેલ્થક્લબ + સીક્યોરીટી કેબીન + ક્લબહાઉસ)	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ (કોમર્સિયલ)	એમુલ (રહેણાંક)	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન)		
૧	બેઝમેન્ટ	-	-			-	૧૦૮૩.૭૪	-	-	૧૦૮૩.૭૪	-	-			-	-	-	-	૦.૦૦	વાણિજ્ય + રહેણાંક + કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન
૨	ગ્રાઉન્ડ ફ્લોર	૭૮૭૮.૦૩	૨૦૧.૭૫	૨૨૮૬૬.૭૨		-	૧૦૮૩.૭૪	૬૧૮૨.૬૮	૧૨૬૭.૮૪	૩૮૫૮૧.૭૬	૬૭.૦૦	૧.૦૦	૮૮		-	૧	૫૬	૧	૨૨૪.૦૦	
૩	ફર્સ્ટ ફ્લોર	૭૭૮૪.૭૩	-	૧૪૪૮૭.૦૮		-	૧૦૮૩.૭૪	૬૦૪૧.૮૮	-	૨૮૪૦૭.૪૪	-	-			-	૧	-	-	૧.૦૦	
૪	સેકન્ડ ફ્લોર	૧૨૬૭.૬૫	-	૧૧૩૬.૬૮		-	૧૦૮૩.૭૪	૧૧૮૩.૪૦	-	૪૬૮૧.૪૮	-	-			-	૧	-	-	૧.૦૦	
૫	સ્ટેર કેબીન + O.H.W.T.	-	-			-	૬૬.૮૪	-	-	૬૬.૮૪	-	-			-	-	-	-	૦.૦૦	
૬	લીફ્ટ મશીન રૂમ	-	-			-	૮૧.૨૦	-	-	૮૧.૨૦	-	-			-	-	-	-	૦.૦૦	
	કુલ	૧૭૦૩૧.૪૧	૨૦૧.૭૫	૩૮૫૦૦.૫૦	૦.૦૦	૦.૦૦	૪૪૮૩.૦૦	૧૩૪૨૭.૮૬	૧૨૬૭.૮૪	૭૪૮૧૨.૪૬	૬૭.૦૦	૧.૦૦	૮૮.૦૦	૦.૦૦	૦.૦૦	૩.૦૦	૫૬.૦૦	૧.૦૦	૨૨૬.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પે, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પે, ૪૩૪/પે તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનખેતીનો હુકમ રજુ કરવાનો રહેશે.

(૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

રી. પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧
અમદાવાદ.

૦૦૦૩૬૩

10 JUN 2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/દ્/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : રહેણાંક + કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન

અ.નં.	માળ/યુનીટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)									યુનીટ									બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૩		સેક્ટર-૪		સેક્ટર-૫		સેક્ટર-૬		કુલ	સેક્ટર-૩		સેક્ટર-૪		સેક્ટર-૫		સેક્ટર-૬		કુલ	
		એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ	એમુલ	રીવાઈઝ્ડ			એમુલ	રીવાઈઝ્ડ (રહેણાંક + કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન)	એમુલ	રીવાઈઝ્ડ (રહેણાંક)	એમુલ	રીવાઈઝ્ડ (રહેણાંક)	એમુલ (રહેણાંક)		રીવાઈઝ્ડ
૧	હોલો પ્લીન્થ	-	-	-	૩૪૨૭૮.૪૧	-	-	-	-	૩૪૨૭૮.૪૧	-	-	-	-	-	-	-	-	૦.૦૦	રહેણાંક + કોમ્યુનીટી હોલ + સીક્યોરીટી કેબીન
૨	ગ્રાઉન્ડ ફ્લોર	૧૨૧૪૭.૪૮	૩૩૨૪.૩૮	-	૩૪૨૭૮.૪૧	-	૧૪૪૧૫.૬૩	-	૨૫૭૪.૨૮	૬૬૭૪૦.૧૮	૧૦૪	૧૮	-	૨૪૪	-	૮૫	૨૧	-	૪૮૩.૦૦	
૩	ફર્સ્ટ ફ્લોર	૧૧૨૦૦.૫૨	૨૮૫૨.૦૩	-	૩૪૨૭૮.૪૧	-	૧૦૮૧૮.૨૨	-	૨૩૬૮.૪૮	૬૧૫૧૭.૬૬	-	-	-	૨૪૪	-	-	-	-	૨૪૪.૦૦	
૪	સેકન્ડ ફ્લોર	૨૨૨૫.૮૮	૫૦૦.૫૨	-	૩૪૨૭૮.૪૧	-	૪૮૬૭.૩૫	-	૪૭૨.૦૮	૪૨૪૪૪.૩૫	-	-	-	૨૪૪	-	-	-	-	૨૪૪.૦૦	
૫	સ્ટેર કેબીન	-	-	-	૨૬૩૪.૩૬	-	-	-	-	૨૬૩૪.૩૬	-	-	-	-	-	-	-	-	૦.૦૦	
૬	લીફ્ટ મશીન રૂમ + O.H.W.T.	-	-	-	૨૨૭૧.૪૨	-	૪૮૬.૫૩	-	-	૨૭૬૭.૯૫	-	-	-	-	-	-	-	-	૦.૦૦	
	કુલ	૨૫૫૭૪.૦૦	૬૬૭૬.૮૩	૦.૦૦	૧૪૨૦૧૮.૪૨	૦.૦૦	૩૦૬૮૭.૭૩	૦.૦૦	૫૪૧૪.૮૪	૨૧૦૩૮૨.૮૨	૧૦૪.૦૦	૧૮.૦૦	૦.૦૦	૭૩૨.૦૦	૦.૦૦	૮૫.૦૦	૨૧.૦૦	૦.૦૦	૮૭૧.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પે, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પે, ૪૩૪/પે તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનપેતીનો હુકમ રજુ કરવાનો રહેશે.

(૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

રી. પીઆરએમ/દ્/૦૩/૨૦૧૧
અમદાવાદ.

000363

10 JUN 2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

બાંધકામ એન્જીનીયરની સહી છે
સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : રહેણાંક + કોમ્યુનીટી હોલ

અ.નં.	માળ/યુનિટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)					યુનિટ					બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૭	સેક્ટર-૮	સેક્ટર-૯	સેક્ટર-૧૦	કુલ	સેક્ટર-૭	સેક્ટર-૮	સેક્ટર-૯	સેક્ટર-૧૦	કુલ	
		રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ			રીવાઈઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (રહેણાંક+કોમ્યુનીટી હોલ)		રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (રહેણાંક)
૧	હોલો પ્લીનથ	૭૨૨૨.૨૧	૩૮૬.૩૪	-	૧૨૨૮૨.૪૦	૧૮૮૦૦.૯૫	-	-	-	-	૦.૦૦	રહેણાંક + કોમ્યુનીટી હોલ
૨	ગ્રાઉન્ડ ફ્લોર	૭૨૨૨.૨૧	૩૮૬.૩૪	૮૭૦૬.૩૭	૧૨૮૦૮.૦૬	૩૦૧૩૨.૮૮	૧૧૧	૨	૮૧	૬૬	૨૬૦.૦૦	
૩	ફર્સ્ટ ફ્લોર	૭૨૨૨.૨૧	૩૮૬.૩૪	૮૨૮૫.૮૬	૧૨૫૬૨.૮૩	૨૮૪૬૭.૪૪	-	૨	-	૬૪	૬૬.૦૦	
૪	સેકન્ડ ફ્લોર	૭૨૨૨.૨૧	૩૮૬.૩૪	૧૮૩૬.૦૦	૧૨૨૮૨.૪૦	૨૧૭૩૬.૯૫	-	૨	-	૬૪	૬૬.૦૦	
૫	સ્ટેર કેબીન	૨૭૮.૪૬	૩૬.૪૮	-	૮૧૦.૨૫	૧૨૨૬.૧૮	-	-	-	-	૦.૦૦	
૬	લીફ્ટ મશીન રૂમ + O.H.W.T.	૧૮૭.૬૪	૩૧.૮૬	-	૩૭૩.૦૫	૬૦૨.૫૫	-	-	-	-	૦.૦૦	
	કુલ	૨૮૩૬૫.૮૪	૧૬૫૩.૭૦	૨૦૮૨૮.૩૩	૫૧૨૧૮.૦૮	૧૦૩૦૬૭.૦૬	૧૧૧.૦૦	૬.૦૦	૮૧.૦૦	૧૮૪.૦૦	૩૮૨.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પૈ, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પૈ, ૪૩૪/પૈ તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનખેતીનો હકમ રજુ કરવાનો રહેશે. (૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

રી. પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧
અમદાવાદ.

૦૦૦૩૬૩

10 JUN 2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

નાંધ પર ચેરમેનશ્રીની સહી છે

સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/૬૯/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : રહેણાંક + કોમ્યુનીટી હોલ

અ.નં.	માળ/યુનીટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)						યુનીટ						બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૧૧		સેક્ટર-૧૨	સેક્ટર-૧૩	સેક્ટર-૧૪	કુલ	સેક્ટર-૧૧		સેક્ટર-૧૨	સેક્ટર-૧૩	સેક્ટર-૧૪	કુલ	
		એમુલ	રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ		એમુલ	રીવાઈઝ્ડ (રહેણાંક+કોમ્યુનીટી હોલ)	રીવાઈઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (રહેણાંક)		
૧	બેઝમેન્ટ	૪૦૩૮.૨૫	૪૧૭.૭૫	-	-	-	૪૪૫૬.૦૦	-	-	-	-	-	૦.૦૦	રહેણાંક + કોમ્યુનીટી હોલ
૨	હોલોપ્લીનથ	-	-	૧૪૩૦૭.૮૮	-	૧૩૦૦૩.૫૬	૨૭૩૧૧.૪૪	-	-	-	-	-		
૩	ગ્રાઉન્ડ ફ્લોર	૮૫૩૬.૧૫	૩૫૨૫.૪૬	૧૪૩૦૭.૮૮	૨૮૮૬૭.૪૦	૧૩૦૦૩.૫૬	૬૮૩૪૦.૪૫	૩૪.૦૦	૧૮	૧૦૨	૧૦૫	૧૮	૨૭૮.૦૦	
૪	ફર્સ્ટ ફ્લોર	૬૭૩૮.૮૮	૨૮૨૭.૮૭	૧૪૩૦૭.૮૮	૨૦૦૧૮.૩૩	૧૩૦૦૩.૫૬	૫૬૮૮૮.૫૩	-	-	૧૦૨	-	૧૮	૧૨૦.૦૦	
૫	સેકન્ડ ફ્લોર	૨૦૧.૮૪	૩૮૬.૬૭	૧૪૩૦૭.૮૮	૨૨૭૮.૧૪	૧૩૦૦૩.૫૬	૩૦૧૮૮.૦૮	-	-	૧૦૨	-	૧૮	૧૨૦.૦૦	
૬	સ્ટેર કેબીન	-	-	૧૦૮૪.૨૨	-	૧૦૧૪.૬૬	૨૧૦૮.૮૮	-	-	-	-	-	૦.૦૦	
૭	લીફ્ટ મશીન રૂમ + O.H.W.T.	-	-	૮૩૬.૪૮	-	૮૭૦.૪૮	૧૮૦૬.૮૬	-	-	-	-	-	૦.૦૦	
	કુલ	૧૮૫૧૬.૧૩	૭૨૬૭.૭૫	૫૮૨૬૨.૨૨	૫૧૨૬૫.૮૭	૫૩૮૮૮.૩૮	૧૮૧૨૧૧.૩૫	૩૪.૦૦	૧૮.૦૦	૩૦૬.૦૦	૧૦૫.૦૦	૫૪.૦૦	૫૧૮.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ કલીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પૈ, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પૈ, ૪૩૪/પૈ તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનખેતીનો હુકમ રજુ કરવાનો રહેશે.

(૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

રી. પીઆરએમ/૬૯/૦૩/૨૦૧૧
અમદાવાદ.

૦૦૦૩૬૩

10 JUN 2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ
અમદાવાદ

એનેક્ષર : એ

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/૬૯/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : રહેણાંક

ર	માળ/યુનિટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)					યુનિટ					બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૧૫	સેક્ટર-૧૬	સેક્ટર-૧૭	સેક્ટર-૧૮	કુલ	સેક્ટર-૧૫	સેક્ટર-૧૬	સેક્ટર-૧૭	સેક્ટર-૧૮	કુલ	
		રીવાઈઝ્ડ	પ્રપોઝ્ડ	રીવાઈઝ્ડ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ			રીવાઈઝ્ડ (રહેણાંક)	પ્રપોઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ (રહેણાંક)		રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (રહેણાંક)
૧	હોલોપ્લીન્થ	૮૦૮૬.૨૧	૧૧૨૮૦.૨૮	૭૮૨.૬૮	-	૨૧૧૬૮.૧૮	-	-	-	-	૦.૦૦	રહેણાંક
૨	ગ્રાઉન્ડ ફ્લોર	૮૦૮૬.૨૧	૧૧૨૮૦.૨૮	૭૮૨.૬૮	૧૫૨૭૬.૦૪	૩૬૪૪૫.૨૨	૬૪.૦૦	૮૦	૪	૧૧૪	૨૬૨.૦૦	
૩	ફર્સ્ટ ફ્લોર	૮૦૮૬.૨૧	૧૧૨૮૦.૨૮	૭૮૨.૬૮	૧૩૦૫૫.૮૮	૩૪૨૨૫.૧૬	૬૪.૦૦	૮૦	૪	-	૧૪૮.૦૦	
૪	સેકન્ડ ફ્લોર	૮૦૮૬.૨૧	૧૧૨૮૦.૨૮	૭૮૨.૬૮	૨૭૮૩.૨૪	૨૩૮૫૨.૪૨	૬૪.૦૦	૮૦	૪	-	૧૪૮.૦૦	
૫	સ્ટેર કેબીન	૭૨૧.૫	૮૬૭.૦૮	૭૨.૮૬	-	૧૬૬૧.૫૫	-	-	-	-	૦.૦૦	
૬	લીફ્ટ મશીન રૂમ + O.H.W.T.	૬૦૭.૮૬	૭૪૨.૪૭	૬૩.૭૨	-	૧૪૧૪.૧૫	-	-	-	-	૦.૦૦	
	કુલ	૩૭૬૭૪.૩૦	૪૬૭૭૦.૭૨	૩૩૦૭.૪૦	૩૧૧૧૫.૨૬	૧૧૮૮૬૭.૬૮	૧૮૨.૦૦	૨૪૦.૦૦	૧૨.૦૦	૧૧૪.૦૦	૫૫૮.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પૈ, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પૈ, ૪૩૪/પૈ તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનખેતીનો હુકમ રજુ કરવાનો રહેશે.

(૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

રી. પીઆરએમ/૬૯/૦૩/૨૦૧૧
અમદાવાદ.

૦૦૦૩૬૩

10 JUN 2011

નાયબ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

વિકાસ પરવાનગી માટેનું એનેક્ષર, ગામ : સનાથલ + તેલાવ, પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧

મોજે ગામ સનાથલ + તેલાવ તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ સનાથલના બ્લોક નં. ૭૮, ૧૦૦૭, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૦૩, ૧૧૦૨, ૧૦૦૬, ૧૦૮૪, ૧૦૮૭, ૧૧૧૮/પી/૧, ૧૦૩૭ તથા તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પી, ૪૧૦, ૪૧૨, ૪૧૩, ૪૧૫, ૪૧૬/૧, ૪૧૬/૨, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૫/૩, ૪૨૬/૧, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૨૯, ૪૩૦, ૪૩૧/પી, ૪૩૨, ૪૩૪/પી ની ૧૦૧૨૪૧૮.૦૦ ચો.મીટર જમીન તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

ક્રમાંકનું વર્ણન : રહેણાંક

અ.નં.	ભાગ/યુનીટ/બ્લોક	બાંધકામ (બિલ્ટઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.)							યુનીટ							બાંધકામનો ઉપયોગ
		સેક્ટર-૧૯	સેક્ટર-૨૦	સેક્ટર-૨૧	સેક્ટર-૨૨	સેક્ટર-૨૩	સેક્ટર-૨૪	કુલ	સેક્ટર-૧૯	સેક્ટર-૨૦	સેક્ટર-૨૧	સેક્ટર-૨૨	સેક્ટર-૨૩	સેક્ટર-૨૪	કુલ	
		પ્રપોઝ્ડ	પ્રપોઝ્ડ	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ	રીવાઈઝ્ડ	પ્રપોઝ્ડ	રીવાઈઝ્ડ		પ્રપોઝ્ડ (રહેણાંક)	પ્રપોઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ + પ્રપોઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ (રહેણાંક)	પ્રપોઝ્ડ (રહેણાંક)	રીવાઈઝ્ડ (રહેણાંક)		
૧	હોલોપ્લીન્થ	૫૫૧૦.૮૩	-	-	-	૨૪૫૧૪.૪૮	-	૩૦૦૨૫.૪૧	-	-	-	-	-	-	૦.૦૦	રહેણાંક
૨	ગ્રાઉન્ડ ફ્લોર	૫૫૧૦.૮૩	૧૧૭૫.૧૦	૧૧૫૩૦.૭૧	૩૦૩૨૫.૫૮	૨૪૫૧૪.૪૮	૫૮૧.૧૫	૭૩૬૪૭.૮૬	૪૦.૦૦	૧૦	૪૩	૩૨૦	૩૩૮	૫	૭૫૭.૦૦	
૩	ફર્સ્ટ ફ્લોર	૫૫૧૦.૮૩	૧૧૪૬.૧૫	૮૩૦૪.૮૮	૨૪૭૬૮.૦૨	૨૪૫૧૪.૪૮	૫૭૩.૨૫	૬૪૮૧૭.૮૨	૪૦.૦૦	-	-	-	-	-	૪૦.૦૦	
૪	સેકન્ડ ફ્લોર	૫૫૧૦.૮૩	૨૨૪.૮૦	-	૧૬૧૩૬.૬૧	૨૪૫૧૪.૪૮	૧૧૪.૭૫	૪૬૫૦૧.૫૭	૪૦.૦૦	-	-	-	-	-	૪૦.૦૦	
૫	સ્ટેર કેબીન	૪૧૬.૧૩	-	-	-	-	-	૪૧૬.૧૩	-	-	-	-	-	-	૦.૦૦	
૬	લીફ્ટ મશીન રૂમ + O.H.W.T.	૩૫૫.૫૮	-	-	-	-	-	૩૫૫.૫૮	-	-	-	-	-	-	૦.૦૦	
	કુલ	૨૨૮૧૫.૪૪	૨૫૪૬.૦૫	૧૮૮૩૫.૭૦	૭૧૨૩૦.૨૨	૮૮૦૫૭.૮૨	૧૨૭૮.૧૫	૨૧૫૭૬૪.૪૮	૧૨૦.૦૦	૧૦.૦૦	૪૩.૦૦	૩૨૦.૦૦			૮૩૭.૦૦	

શરતો : (૧) વધારાની કુલ ૧,૮૭,૬૬૬ ચો.મી. જગ્યાનું એન્વાયર્મેન્ટ ક્લીયરન્સ બાંધકામ ચાલુ કરતાં પહેલા રજુ કરવાનું રહેશે.

(૨) મોજે તેલાવના બ્લોક નં. ૪૦૬/૧, ૪૦૬/૨, ૪૧૧/પૈ, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૨૫/૧, ૪૨૫/૨, ૪૨૬/૨, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૨૮, ૪૩૦, ૪૩૧/પૈ, ૪૩૪/પૈ તથા સનાથલના બ્લોક નં. ૧૦૩૭ નું બાંધકામ ચાલુ કરતાં પહેલા બીનપેતીનો હુકમ રજુ કરવાનો રહેશે (૩) ૩૦.૦ મીટરનો રોડ, ૧૮.૦ મીટર રોડ તથા ૧૨.૦ મીટરનો રોડ જાહેર જનાતની અવર જવર માટે કાયમ માટે ખુલ્લો રાખવાનો રહેશે.

રી. પીઆરએમ/૬૮/૦૩/૨૦૧૧
અમદાવાદ.

૦૦૦૩૬૩

10 JUN 2011


નાયબ મેગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ,
અમદાવાદ.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

સિનિયર નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ